

ભાગ 1 (વ્યાજ દર અને ફી/ચાર્જિસ)

1	લોન પ્રસ્તાવ/એકાઉન્ટ નંબર		લોનનો પ્રકાર					
2	મંજૂર લોનની રકમ (રૂપિયામાં)		INR					
3	વિતરણ શેડ્યૂલ (i) તબક્કાવાર અથવા 100% અગાઉથી કરાયેલ વિતરણ. (ii) જો તે તબક્કાવાર હોય, તો સંબંધિત વિગતો સાથે લોન એગ્રીમેન્ટના કલોઝનો ઉલ્લેખ કરો.		વિતરણ શેડ્યૂલ વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) પર આધાર રાખે છે, જેની વિગતો લોન એગ્રીમેન્ટના સામાન્ય નિયમો અને શરતોના ફક્ત 5 માં વાંચી શકાય છે.					
4	લોનની મુદત (વર્ષ/મહિના/દિવસો)		મહિના					
5	હપ્તાની વિગતો							
	હપ્તાઓનો પ્રકાર	EPI ની સંખ્યા	EPI (₹)	મંજૂરી પછી, પુનઃચુકવણીની શરૂઆત				
	માસિક	(EPI માં EMI અને પ્રી-EMI, જો કોઈ હોય તો, બંનેનો સમાવેશ થાય છે)	ભારતીય રૂપિયા	દિવસ સુધી				
6	વ્યાજ દર (%) અને પ્રકાર (ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ અથવા હાઇબ્રિડ)		% અને					
7	ફ્લોટિંગ વ્યાજ દરના કિસ્સામાં વધારાની માહિતી							
	સંદર્ભ બેન્ચમાર્ક	બેન્ચમાર્ક દર (%) (B)	સ્પેડ (%) (S)	ફાઇનલ દર (%) R = (B) + (S)	સામયિકતા રીસેટ કરો (મહિનાઓ)	સંદર્ભ બેન્ચમાર્કમાં ફેરફારની અસર ('R' માં 25 bps ફેરફાર માટે, : માં ફેરફાર)		
					B	S	EPI (₹) (સ્થાયી મુદતને ધ્યાનમાં રાખીને.)	EPI ની સંખ્યા (સ્થાયી EPI ને ધ્યાનમાં રાખીને.)
	GFLPLR				NA	NA		
8	ફી/ચાર્જિસ							
			RE (A) ને ચૂકવવાપાત્ર		RE (B) દ્વારા તૃતીય પક્ષને ચૂકવવાપાત્ર			
			એક વખતનું/રિકરીંગ (આવર્તક)	લાગુ પડતી રકમ (₹ માં) અથવા ટકાવારી (%)	એક વખતનું/રિકરીંગ (આવર્તક)	લાગુ પડતી રકમ (₹ માં) અથવા ટકાવારી (%)		
(i)	પ્રોસેસિંગ ફી*		એક વખત					
(ii)	સ્ટેમ્પિંગ અથવા ફ્રેન્કિંગ				એક વખત			
(iii)	વીમા ચાર્જિસ				એક વખત			
(iv)	કાનૂની અને ટેકનિકલ શુલ્ક		એક વખત					
(vi)	નાણાકીય સુખાકારી અહેવાલ માટેની ફી		એક વખત					
9	વાર્ષિક ટકાવારી દર (APR) (%)							
10	આકસ્મિક ચાર્જિસની વિગતો (લાગુ પડતા ₹ અથવા % માં)							
(i)	દર મહિને 1લી પ્રસ્તુતિનો હપ્તો બાઉન્સ				1,000			
(ii)	2જી પ્રસ્તુતિ દર મહિને હપ્તો બાઉન્સ				1,000			
(iii)	મોડી ચુકવણી દંડ				કુલ બાકી હપ્તાના 2% (મુદ્દલ + વ્યાજ)			
(iv)	હસ્તાવેજો સબમિટ ન કરવા બદલ દર મહિને વસૂલવામાં આવતો દંડ.				PDD સબમિટ કરવાની નિયત તારીખથી દર મહિને 1000			
(v)	લોન રદ કરવા અંગેના ચાર્જિસ				પ્રથમ વિતરણની તારીખ બાદ 3 કેલેન્ડર દિવસ સુધી શૂન્ય. આ સમયગાળા પછી ફોરકલોઝર ચાર્જિસ લાગુ થશે			
(vi)	ચુકવણી મોડ - (ચેક / NACH) સ્વેપ				500			
(vii)	એકાઉન્ટનું ભૌતિક સ્ટેટમેન્ટ				500			

(viii)	ભૌતિક ડુપ્લિકેટ NOC	500
(ix)	ભૌતિક ચુકવણી સમયપત્રક	500
(x)	દસ્તાવેજોની યાદી	1,000
(xi)	હપ્તા ઉપાડ	500
(xii)	લોન ફોરકલોઝર પત્ર ઇશ્યૂ કરવા અંગેના ચાર્જિસ	500
(xiii)	કાનૂની/ SARFAESI/ વસૂલાત કાર્યવાહી સંબંધિત ચાર્જિસ	વાસ્તવિક ખર્ચને આધારે
(xiv)	ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર ફરીથી ઇશ્યૂ કરવો અથવા રદ કરવો	750
(xv)	અન્ય દસ્તાવેજો	500
(xvi)	વિવિધ શુલ્ક	વાસ્તવિક ખર્ચને આધારે
(xvii)	મિલકતના દસ્તાવેજોની ભૌતિક નકલ	2,000
(xviii)	રૂપાંતર અથવા સ્વિચ ચાર્જ (ફ્લોટિંગથી ફિક્સ્ડ અથવા ફિક્સ્ડથી ફ્લોટિંગ)	બાકી મુખ્ય રકમના 1.5% સુધી
(xix)	રિપ્રાઇસિંગ ફી	નીચે દર્શાવેલ સ્લેબ મુજબ, બાકી રહેલી મુદ્દલ રકમ અથવા ઉપાડ મર્યાદા (ફ્લેક્સી ફંડ્સના કિસ્સામાં) પર લાગુ: <ul style="list-style-type: none"> ₹1 કરોડ સુધી - 0.10% 1 કરોડ અને ₹10,000 થી વધુ
(xx)	ટેકનિકલ ફી (વધારાની સંપત્તિ માટે)	વાસ્તવિક ખર્ચને આધારે
(xxi)	સ્ટેમ્પ ડ્યુટી / રજીસ્ટ્રેશન / મોર્ટગેજની સૂચના / મોર્ટગેજ તૈયાર કરવા માટેના ચાર્જિસ	સંબંધિત સરકારી સત્તાધિકારી દ્વારા લાગુ અને નિર્ધારિત કરાયા મુજબ

સુરક્ષિત લોન માટે વિશિષ્ટ - નોન-રેસિડેન્શિયલ સંપત્તિ (NRP), સંપત્તિ સામે લોન (LAP), લોન બેલેન્સ ટ્રાન્સફર (LT)

1 જાન્યુઆરી '26 પહેલાં મંજૂર કરાયેલી લોન માટે ફોરકલોઝર અને આંશિક પૂર્વ ચુકવણી શુલ્ક લાગુ પડશે.

ઉદારકર્તાનો પ્રકાર	લોનનો પ્રકાર	ROI નો પ્રકાર	ઉપયોગિતા
વ્યક્તિગત	(a) બિઝનેસ હેતુ સિવાય LAP	ફ્લોટિંગ, સેમી-ફિક્સ્ડ (ROI ફ્લોટિંગ હોય તે સમયગાળા દરમિયાન)	શૂન્ય
		ફિક્સ્ડ વ્યાજ દર	શૂન્ય - જો પોતાના સ્ત્રોતના ફંડ્સ દ્વારા ચુકવણી કરવામાં આવે તો કોઈપણ અન્ય નાણાકીય સંસ્થા દ્વારા બેલેન્સ ટેકઓવરના કિસ્સામાં પ્રિપેઇડ રકમ પર 4%
	(b) LAP બિઝનેસ	ફ્લોટિંગ, ફિક્સ્ડ અને સેમી-ફિક્સ્ડ	બેંક/HFC/NBFC/અન્ય કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી બેલેન્સ ટેકઓવર - મુદ્દલ પ્રિ-પેઇડ પર ફોરકલોઝર માટે 4%
	(c) નોન-રેસિડેન્શિયલ ખરીદી લોન		સ્વ-પ્રાયોજિત - નાણાકીય વર્ષમાં પ્રિપેઇડ રકમ બાકી રહેલ લોન રકમના 20% થી વધુ હોય તો મુદ્દલ પ્રિપેઇડ પર 4%.
બિન-વ્યક્તિગત	તમામ	કોઈપણ	મુદ્દલ પ્રિ-પેઇડ પર 4%

સુરક્ષિત લોન માટે વિશિષ્ટ - બિન-રહેણાંક (NRP), મિલકત સામે લોન (LAP), બેલેન્સ લોન ટ્રાન્સફર (LT), લીઝ રેટલ ડિસ્કાઉન્ટિંગ (LRD)

1 જાન્યુઆરી 26 પહેલાં મંજૂર કરાયેલી લોન માટે ફોરકલોઝર અને આંશિક પૂર્વ ચુકવણી શુલ્ક લાગુ પડશે

ઉદારકર્તાનો પ્રકાર	લોનનો પ્રકાર	ROI નો પ્રકાર	ઉપયોગિતા
વ્યક્તિગત	LAP વ્યવસાય /બિન-રહેણાંક ખરીદી	નિશ્ચિત વ્યાજ દર અને અર્ધ-નિશ્ચિત (જો ROI નિશ્ચિત હોય તો પૂર્વ-ચુકવણી સમયે)	ફોરકલોઝર - જો લેણદાર લોન ફોરકલોઝ (મુદત પહેલાં બંધ) કરે તો: <ul style="list-style-type: none"> લોન વિતરણની તારીખથી 12 મહિનાની અંદર, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 6% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. લોન વિતરણની તારીખથી 12 મહિના પછી, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 4% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. આંશિક ચુકવણી - જો ઋણ લેનાર વર્ષ દરમિયાન ગમે ત્યારે મુદ્દલની પૂર્વ ચુકવણી કરે (એક જ વખતમાં અને

			<p>અનેક વખત કરેલ ચુકવણીને એકસાથે ગણીને) અને મુદ્દલની કુલ પૂર્વ ચુકવણી નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ હોય, તો નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ રકમની આવી પૂર્વ ચુકવણી પર 4% ના દરે શુલ્ક વસૂલવામાં આવશે.</p>
		ફ્લોટિંગ અને અર્ધ-નિશ્ચિત (જો ROI ફ્લોટિંગ હોય તો પૂર્વ ચુકવણી સમયે)	<p>₹50 લાખ સુધીની મંજૂર લોન રકમ - શૂન્ય</p> <p>50 લાખથી વધુની મંજૂર લોન રકમ -</p> <p>ફોરકલોઝર - જો લેણદાર લોન ફોરકલોઝ (મુદત પહેલા બંધ) કરે તો:</p> <ul style="list-style-type: none"> લોન વિતરણની તારીખથી 12 મહિનાની અંદર, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 6% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. લોન વિતરણની તારીખથી 12 મહિના પછી, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 4% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. <p>આંશિક ચુકવણી - જો ઋણ લેનાર વર્ષ દરમિયાન ગમે ત્યારે મુદ્દલની પૂર્વ ચુકવણી કરે (એક જ વખતમાં અને અનેક વખત કરેલ ચુકવણીને એકસાથે ગણીને) અને મુદ્દલની કુલ પૂર્વ ચુકવણી નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ હોય, તો નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ રકમની આવી પૂર્વ ચુકવણી પર 4% ના દરે શુલ્ક વસૂલવામાં આવશે.</p>
	વ્યવસાય હેતુ સિવાયના LAP	ફ્લોટિંગ અને અર્ધ-નિશ્ચિત (જો ROI ફ્લોટિંગ હોય તો પૂર્વ ચુકવણી સમયે)	શૂન્ય
		નિશ્ચિત વ્યાજ દર અને અર્ધ-નિશ્ચિત (જો ROI નિશ્ચિત હોય તો પૂર્વ-ચુકવણી સમયે)	<p>ફોરકલોઝર - જો લેણદાર લોન ફોરકલોઝ (મુદત પહેલા બંધ) કરે તો:</p> <ul style="list-style-type: none"> લોન વિતરણની તારીખથી 12 મહિનાની અંદર, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 6% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. લોન વિતરણની તારીખથી 12 મહિના પછી, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 4% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. <p>આંશિક ચુકવણી - જો ઋણ લેનાર વર્ષ દરમિયાન ગમે ત્યારે મુદ્દલની પૂર્વ ચુકવણી કરે (એક જ વખતમાં અને અનેક વખત કરેલ ચુકવણીને એકસાથે ગણીને) અને મુદ્દલની કુલ પૂર્વ ચુકવણી નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ હોય, તો નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ રકમની આવી પૂર્વ ચુકવણી પર 4% ના દરે શુલ્ક વસૂલવામાં આવશે.</p>
બિન-વ્યક્તિગત (નોન-એમએસઈએસ)	કોઈપણ	નિશ્ચિત, ફ્લોટિંગ અને અર્ધ-નિશ્ચિત	<p>ફોરકલોઝર - જો લેણદાર લોન ફોરકલોઝ (મુદત પહેલા બંધ) કરે તો:</p> <ul style="list-style-type: none"> લોન વિતરણની તારીખથી 12 મહિનાની અંદર, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 6% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. લોન વિતરણની તારીખથી 12 મહિના પછી, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal

			<p>Outstanding) હોય તેના પર 4% લેખે ચાર્જ વસૂલવામાં આવશે.</p> <p>આંશિક ચુકવણી - જો ઋણ લેનાર વર્ષ દરમિયાન ગમે ત્યારે મુદ્દલની પૂર્વ ચુકવણી કરે (એક જ વખતમાં અને અનેક વખત કરેલ ચુકવણીને એકસાથે ગણીને) અને મુદ્દલની કુલ પૂર્વ ચુકવણી નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ હોય, તો નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ રકમની આવી પૂર્વ ચુકવણી પર 4% ના દરે શુલ્ક વસૂલવામાં આવશે.</p>
કોઈપણ	નિશ્ચિત વ્યાજ દર અર્ધ-નિશ્ચિત અર્ધ-નિશ્ચિત (ROI નિશ્ચિત હોય તે સમયગાળા દરમિયાન)		<p>ફોરકલોઝર - જો લેણદાર લોન ફોરકલોઝ (મુદત પહેલા બંધ) કરે તો:</p> <ul style="list-style-type: none"> • લોન વિતરણની તારીખથી 12 મહિનાની અંદર, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 6% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. • લોન વિતરણની તારીખથી 12 મહિના પછી, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 4% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. <p>આંશિક ચુકવણી - જો ઋણ લેનાર વર્ષ દરમિયાન ગમે ત્યારે મુદ્દલની પૂર્વ ચુકવણી કરે (એક જ વખતમાં અને અનેક વખત કરેલ ચુકવણીને એકસાથે ગણીને) અને મુદ્દલની કુલ પૂર્વ ચુકવણી નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ હોય, તો નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ રકમની આવી પૂર્વ ચુકવણી પર 4% ના દરે શુલ્ક વસૂલવામાં આવશે.</p>
કોઈપણ	ફ્લોટિંગ અને અર્ધ-નિશ્ચિત (જો ROI ફ્લોટિંગ હોય તો પૂર્વ ચુકવણી સમયે)	<p>50 લાખ સુધીની મંજૂર લોન રકમ - ફોરકલોઝર અને આંશિક-પૂર્વ-ચુકવણી - શૂન્ય</p> <p>50 લાખથી વધુની મંજૂર લોન રકમ -</p> <p>ફોરકલોઝર - જો લેણદાર લોન ફોરકલોઝ (મુદત પહેલા બંધ) કરે તો:</p> <ul style="list-style-type: none"> • લોન વિતરણની તારીખથી 12 મહિનાની અંદર, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 6% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. • લોન વિતરણની તારીખથી 12 મહિના પછી, ફોરકલોઝરની તારીખે જે 'બાકી મુદ્દલ' (Principal Outstanding) હોય તેના પર 4% લેખે ચાર્જ વસૂલવામાં આવશે. <p>આંશિક ચુકવણી - જો ઋણ લેનાર વર્ષ દરમિયાન ગમે ત્યારે મુદ્દલની પૂર્વ ચુકવણી કરે (એક જ વખતમાં અને અનેક વખત કરેલ ચુકવણીને એકસાથે ગણીને) અને મુદ્દલની કુલ પૂર્વ ચુકવણી નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ હોય, તો નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બાકી રહેલી મુદ્દલની રકમના 20% થી વધુ રકમની આવી પૂર્વ ચુકવણી પર 4% ના દરે શુલ્ક વસૂલવામાં આવશે.</p>	

*ચુકવેલ પ્રોસેસિંગ ફીમાંથી IMD ફી (બિન-રિફંડપાત્ર) તરીકે ભારતીય રૂપિયા 20,000/- ની રકમ લાગુ કરવામાં આવશે.

1. બંધ કરવાના સમયે પ્રવર્તમાન દર મુજબ વસૂલવામાં આવનારા સેમી-ફિક્સ્ડ પૂર્વ-ચુકવણી શુલ્ક માટે. શુલ્ક સૂચિના નવીનતમ સંસ્કરણ માટે કૃપા કરીને વેબસાઇટ નો સંદર્ભ લો.
2. ફીનું રિફંડ: કોઈપણ સમયે કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
3. વાર્ષિક જાળવણી ચાર્જ (AMC) GFL ના વિવેકબુદ્ધિથી, અગાઉથી/ઉપાજિત ધોરણે આવા ચાર્જ વસૂલવાની તારીખે ઉપયોગને ધ્યાનમાં લીધા વિના, મંજૂરી મર્યાદા/ઉપાડ મર્યાદા પર વસૂલવામાં આવે છે. AMC અને LUC નોન-રિફંડેબલ/નોન-રિવર્સેબલ છે.
4. કૃપા કરીને નોંધ લો: ઉપરોક્ત ફી અને ચાર્જ્સ ઉપરાંત, GST, ભારત સરકાર અથવા સંબંધિત રાજ્ય દ્વારા નિર્ધારિત કોઈપણ ઉપકર અને અન્ય કર, વસૂલાત વગેરે પણ લેવામાં આવશે. વધુમાં, ઉપરોક્ત ફી અને ચાર્જ્સ ફેરફારને આધીન છે અને તે GFLની સંપૂર્ણ વિવેકબુદ્ધિ પર રહેશે.
5. કંપનીએ (તંડોળનો ખર્ચ, કામગીરીનો ખર્ચ, લોન અને સુરક્ષા વગેરે સાથે સંકળાયેલા વિવિધ જોખમોના આધારે વ્યાજ દર મોડેલ અપનાવ્યું છે. એકંદર જોખમના આધારે વધારાનો વ્યાજ દરના સ્ટ્રેડને કિંમતમાં આવરી લેવામાં આવે છે, જે આવક, ક્રેડિટ ઇતિહાસ, ક્રેડિટ માહિતી, ઋણ લેનારની પ્રોફાઇલ, કંપનીના આંતરિક મૂલ્યાંકનને વગેરેને ધ્યાનમાં લે છે.
6. ઋણ લેનાર ધિરાણકર્તાની વેબસાઇટ -
પરની ગોપનીયતા નીતિનો પણ સંદર્ભ લઈ શકે છે.

ભાગ 2 (અન્ય ગુણાત્મક માહિતી)

1	વસૂલાત એજન્ટોની સહભાગિતા સંબંધિત લોન એગ્રીમેન્ટનો કલોઝ	લોન એગ્રીમેન્ટના કલોઝ 16.4 નો સંદર્ભ લો જેમાં વસૂલાત એજન્ટની સહભાગિતા સંબંધિત વિગતો આપવામાં આવી છે.
2	લોન એગ્રીમેન્ટનો કલોઝ જે તકરાર નિવારણ તંત્રની વિગતો આપે છે	કૃપા કરીને લોન એગ્રીમેન્ટના કલોઝ 20 હેઠળ પૂરા પાડવામાં આવેલ તકરાર નિવારણ તંત્રનો સંદર્ભ લો.
3	નોડલ તકરાર નિવારણ અધિકારીનો ફોન નંબર અને ઇમેઇલ આઇડી	નામ: Ashpreet Kaur હોદ્દો: તકરાર નિવારણ અધિકારી ફોન નંબર: +91 08045695305 ઇમેઇલ આઇડી: grievance.redressal@godrejfinance.com
4	શું લોન હાલમાં, અથવા ભવિષ્યમાં, અન્ય RE અથવા સિક્યોરિટાઇઝેશનને આધિન છે (હા/ના)	હા
5	સહયોગી ધિરાણ વ્યવસ્થાઓ (દા.ત., સહ-ધિરાણ/આઉટસોર્સિંગ) હેઠળ ધિરાણના કિસ્સામાં, નીચેની વધારાની વિગતો પૂરી પાડી શકાય છે:	
મૂળ RE નું નામ, તેના ફંડિંગના પ્રમાણ સાથે		પાર્ટનર RE નું નામ અને તેના ફંડિંગનું પ્રમાણ
NA		મિશ્ર વ્યાજ દર
NA		NA
6	ડિજિટલ લોનના કિસ્સામાં, નીચેના ચોક્કસ પ્રગટીકરણો આપી શકાય છે:	
(i)	RE ની બોર્ડ મંજૂર નીતિના સંદર્ભમાં, કુલિંગ ઓફ/લુક-અપ સમયગાળો, જે દરમિયાન ઉધારકર્તા પાસેથી લોનની પૂર્વ-ચુકવણી પર કોઈ દંડ વસૂલ કરવામાં આવશે નહીં.	ડિજિટલ લોનના કિસ્સામાં: કુલિંગ ઓફ/લુક-અપ સમયગાળો લોનના પ્રથમ વિતરણની તારીખથી 3 દિવસનો રહેશે. કંપનીને જાણ કર્યા પછી, આ સમયગાળા દરમિયાન ઉધારકર્તા કોઈપણ દંડ વિના મુદ્દલ અને પ્રમાણસર APR ચુકવીને લોન ફોરકલોઝ કરી શકે છે. કુલિંગ ઓફ સમયગાળા પછી, આંશિક પૂર્વ-ચુકવણી/ફોરકલોઝર/રદીકરણ ચાલિસ ચાલિસના શેડ્યૂલ મુજબ લાગુ પડશે.
(ii)	વસૂલાત એજન્ટ તરીકે કામ કરતી અને ઉધારકર્તાનો સંપર્ક કરવા માટે અધિકૃત LSP ની વિગતો	ડિજિટલ લોનના કિસ્સામાં: રિકવરી એજન્ટોની વિગતો માટે કૃપા કરીને વેબસાઇટનો સંદર્ભ લો.

APR ની ગણતરી

અનુક્રમાંક	પરિમાણ	વિગતો
1	મંજૂર લોનની રકમ (રૂપિયામાં)	₹
2	લોનની મુદત (વર્ષો/મહિનાઓ/દિવસોમાં)	મહિના
a)	બિન-સમાન સામયિક લોનના કિસ્સામાં, મુદ્દલ ચુકવણી માટે હપ્તાઓની સંખ્યા	-
b)	EPI નો પ્રકાર દરેક EPI ની રકમ (રૂપિયામાં) અને EPI ની સંખ્યા (દા.ત., માસિક હપ્તાના કિસ્સામાં EMA ની સંખ્યા)	₹
c)	મૂડીકૃત વ્યાજની ચુકવણી માટે હપ્તાઓની સંખ્યા, જો કોઈ હોય તો	-
d)	મંજૂરી પછી, પુનઃચુકવણીની શરૂઆત	દિવસ સુધી
3	વ્યાજ દરનો પ્રકાર (ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ અથવા હાઇબ્રિડ)	
4	વ્યાજ દર	%
5	લોનની સંપૂર્ણ મુદત દરમિયાન મંજૂર તારીખે પ્રવર્તમાન દર અનુસાર વસૂલ કરવામાં આવનાર કુલ વ્યાજ રકમ (રૂપિયામાં)	₹
6	ચૂકવવાપાત્ર ફી/ચાર્જિસ (રૂપિયામાં)	₹
A	RE ને ચૂકવવાપાત્ર	₹
B	RE દ્વારા રૂટ કરાયેલા તૃતીય-પક્ષને ચૂકવવાપાત્ર	₹
7	ચોખ્ખી વિતરિત રકમ (1-6) (રૂપિયામાં)*	₹
8	ઉધારકર્તા દ્વારા ચૂકવવાની કુલ રકમ (1 અને 5 નો સરવાળો) (રૂપિયામાં)	₹
9	વાર્ષિક ટકાવારી દર - પ્રભાવી વાર્ષિક વ્યાજ દર (ટકાવારીમાં)	%
10	નિયમો અને શરતો અનુસાર વિતરણનું શેકચૂલ	કૃપા કરીને લોન એગ્રીમેન્ટનો સંદર્ભ લો
11	હપ્તા અને વ્યાજની ચુકવણીની નિયત તારીખ	

*આ એ ધારણા પર છે કે કંપની પાસેથી વિતરણ માટે ફી/ચાર્જિસની વિનંતી કરવામાં આવી રહી છે.